https://archive.org/details/bk1065/page/n0/mode/1up
-Kadiya Athamana Laxminarayan Inauguration (1065)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

ૐ

KJ-BK-4-55

શ્રી કડવા પાટીદાર સનાતન
સમાજ

કાદીઆય આથમણી ગઢવાલી - તા. ૨૭-૫-૪૬
મિતી વૈશાખ વદ ૧૧ સોમવાર - ૨૦૦૨
સભાનો સમય - ૮|૧૫ થી ૧૦|૪૫ રાત્રે

જાહેર સભાનો રિપોર્ટ

પ્રમુખની દરખાસ્ત મુકનાર :- મુળજીભાઈ શીવજી ખોંભડી વાળા.

ટેકો આપનાર :- માવજીભાઈ ધનજી નખત્રાણા વાળા.

પ્રમુખ :- હંસરાજભાઈ માના કાદીઆય વાળા.

સનાતન ધર્મકી જય-

મારાજ શ્રી. દયાલ દાશજી - વાંઢાય.

મંગલાચરણ.

આજની સભા શા હેતુથી ભરવામાં આવેલ છે તે જણાવેલ હતું આપણો હિંદુ સમાજ છીન ભીન થઈ ગયેલ છે એટલે આપણને એકતા સાધવી જોઈએ એમ જણાવેલ હતું આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખશું ત્યારેજ એક થશું એમ જાહેર કરી પ્રેમ કેવો હોવો જોઈએ તેવીષે ભજન ગાઈ તેનો ભાવાર્થ સંભળાવેલ હતો શ્રી રતનશી ભાઈ ધોરાણી વાળા. અને લધારામ ભાઈ ખોંભડીવાળાએજે શાદિ હીતનું કાર્ય શીરપર લીધેલ છે તેથી ઘણીજ આનંદની વાત છે. ત્યાર બાદ બહાર ગામથી પધારેલ અગ્રેસરો ની ઓળખાણ સભાને ટુંકમાં કરાવી હતી. ત્યાર બાદ પ્રભુની પ્રાર્થના કરી તેનો ભાવાર્થ કહી સંભળાવેલ હતો. અને બોલનાર ભાઈઓના બોલવા માંથી સાર ગ્રહણ કરવાની સુચના કરી બેસી ગયા હતા.

માવજીભાઈ ધનજી નખત્રાણા વાળા.

આપણી જ્ઞાતિમાં ઘુસી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપી આપણે કોણ છીએ તે આપણને જાણવું જોઈએ. જો આપણી અજ્ઞાનતા દૂર થશે તોજ આપણે હિંદુ સમાજની હરોળમાં ઉભા રહી શકશું અને તે માટે આપણી ભાવિ પ્રજાને કેળવણી ની ખાસ જરૂર છે. જે માટે ગામો ગામ નિશાળો સ્થાપવાની સુચના કરેલ હતી. અને નાનાં ગામોમાં જ્યાં નિશાળ ચલાવવાનું ખર્ચ પુરે ન પડે તેવાં ગામોવાળા ભાઈઓ મુંબઈ સમાજને ખબર આપશે તો તેઓને નિશાળ ચલાવવા માટે નાણાની મદદ પણ મળતી રહેશે એમ જણાવેલ હતું. આપણા જ્ઞાતિ ધર્મના ધર્માદા નાણાંની શું વ્યવસ્થા થાય છે. તે આપણે અજ્ઞાનતાને લીધે જાણી શકતા નથી. જેઓ મેરુણીનો આપણો ધર્માદા પૈસો જ્ઞાતિ કેળવણી કાર્યમાં વપરાયો હોત તો આજે આપણને કેટલા કેંઆ આવી ગયા હોત પરંતુ તે આપણાથી થઈ શકેલ નથી. પરંતુ બાયર હવે જાગ્યા ત્યારથી સવાર ગણી. આપણે સનાતન ઝુંડાનો આશરો લઈ એકબીજા પ્રત્યે પ્રેમ અને સંગઠન સાધી શું તો ટુંક સમયમાં આપણા ભાગ્યોદય જરૂર બદલી જશે અને તેમ કરવા મારા બંધુઓ તેમજ માતાઓને વિનંતી કરું છું અને આશા રાખું છું કે સર્વે એકતા સાધશે હવે હું બેસી જવાની રજા માગું છું.

https://archive.org/details/bk1065/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5, 6, 7.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1065/page/n2/mode/1up
-Kadiya Athamana Laxminarayan Inauguration (1065)
Real Patidar Unravel Truth
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 17:28:39 +05'30'

ૐ. KJ-BK-4-55

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ — કાદીઆય આથમણી ગઢવાળી - તા. ૨૩-૫-૪૬

મીતી વૈશાખ વદ ૧૧ સોમવાર - ૨૦૦૨

સભાનો સમય - ૮।૧૫ થી ૧૧।૪૫ રાત્રે.

જાહેર સભાનો રિપોર્ટ

પ્રભુજીની દરખાસ્ત મુકનાર :- મુળજીભાઈ શીવજી ઝોંભડી વાળા.

ટેકો આપનાર :- માવજીભાઈ ધનજી નખત્રાણા વાળા.

પ્રમુખ :- હંસરાજભાઈ માના કાદીઆય વાળા.

સનાતન ધર્મકી જય-

મારાજ શ્રી. દયાલ દાસજી - વાંઢાય.

મંગલાચરણ.

આજની સભા શા હેતુથી ભરવામાં આવેલ છે તે જણાવેલ હતું આપણો હિંદુ સમાજ છીન ભીન થઈ ગયેલ છે એટલે આપણને એકતા સાધવી જોઈએ એમ જણાવેલ હતું આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખશું ત્યારેજ એક થશું એમ જાહેર કરી પ્રેમ કેળવવો જોઈએ તેથીજ ભજન ગાઈ તેનો ભાવાર્થ સંભળાવેલ હતો શ્રી રતનશી ભાઈ ધીરાણી વાળા. અને લધારામ ભાઈ ઝોંભડીવાળાએજે શાહિબીનું કાર્ય શીર પર લીધેલ છે તે ઘણીજ આનંદની વાત છે. ત્યાર બાદ બહાર ગામથી પધારેલ અગ્રેસરોની ઓળખાણ સભાને ટુંકમાં કરાવી હતી. ત્યાર બાદ પ્રભુની પ્રાર્થના કરી તેનો ભાવાર્થ કહી સંભળાવેલ હતો. અને બોલનાર ભાઈઓના બોલવા માંથી સાર ગ્રહણ કરવાની સુચના કરી બેસી ગયા હતા.

માવજીભાઈ ધનજી નખત્રાણા વાળા.

આપણી જ્ઞાતિમાં ઘુસી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપી આપણે કોણ છીએ તે આપણને જાણવું જોઈએ. જો આપણી અજ્ઞાનતા દૂર થશે ત્યારેજ આપણે હિંદુ સમાજની હરોળમાં ઉભા રહી શકશું અને તે માટે આપણી ભાવિ પ્રજાને કેળવણીની ખાસ જરૂર છે. જે માટે ગામો ગામ નિશાળો સ્થાપવાની સુચના કરેલ હતી. અને નાનાં ગામોમાં જ્યાં નિશાળ ચલાવવાનું ખર્ચ પુરે ન પડે ત્યાં ગામોવાળા ભાઈઓ મુંબઈ સમાજને ખબર આપશે તો તેઓને નિશાળ ચલાવવા માટે નાણાંની મદદ પણ મળતી રહેશે એમ જણાવેલ હતું. આપણા જ્ઞાતિજનના ધર્માદા નાણાંની શું વ્યવસ્થા થાય છે તે આપણે અજ્ઞાનતાને લીધે જાણી શકતા નથી. જેઆ જે સુધીનો આપણો ધર્માદા પૈસો જ્ઞાતિ હિતના કાર્યમાં વપરાયો હોત તો આજે આપણે કેટલાં કેંઆ આગળ વધ્યા હોત પરંતુ તે આપણાથી થઈ શકેલ નથી. પરંતુ બાબત હવે જાગ્યા ત્યારથી સવાર ગણી. આપણે સનાતન ઝુંડાનો આશરો લઈ એકબીજા પ્રત્યે પ્રેમ અને સંગઠન સાધીશું તો ટુંક સમયમાં આપણા સંસ્કારો જરૂર બદલી જશે અને તેમ કરવા મારા બંધુઓ તેમજ માતાઓને વિનંતી કરૂં છું અને આશા રાખું છું કે સર્વે એકતા સાધશે કહેવું બેસી જવાની રજા માગું છું.

KJ-BK-4-56

realpatidar.com

શ્રી. રતનસીંભાઈ જીવરાજ ભીરાણી

હવે આપણી જ્ઞાતિને ઈશ્વરી સંકેત હોય એમ આગાણામાં આવેલ જાગૃતી પરથી સ્પષ્ટ જણાય છે અહીંના ગામ ધણી તરફથી અગે એક ધાબળ સભા કરવાનું મને વચન મળેલ હતું અને તે પ્રમાણે આજે તેઓ શ્રીએ જબાન પાળી છે તે બદલ તેઓશ્રીને ધન્યવાદ આપું છું આપણા બોલવાથી હજુ પણ મારા કેટલાક જ્ઞાન બંધુઓની લાગણી દુભાય છે અને કહે છે કે તમો અમારા ધર્મની નીંદા કરો છો. પરંતુ જ્ઞાતિએ ગંગા એટલે માતા એવા કેવો સંતાન અભાગીઓ હોય કે પોતાની માતાનાં કપડાં ઉંચાં કરે પરંતુ માતાજી રસ્તો ભુલીને કુમાર્ગે જતી હોય તો સત્ય વસ્તુ સમજાવી તેને વારવાની ફરજ સંતાનની છે. અને તે મુજબ આપણે આપણી ફરજ અદા કરી રહેલ છીએ પોતાનું જીવન વૃતાંત ટુંકમાં કહી સંભળાવેલ હતું અને પોતાની જીંદગી જ્ઞાતીસેવાર્થે અર્પણ કરવાનો દૃઢ નિશ્ચય જણાવેલ હતો. આપણે મુસલમાની ધર્મને જુદો પાડી શકીએ નહિ કારણ કે તે સિધ્ધાંતો સહીત છે. અને તે ધર્મની જે નીંદા કરીએ તો મુસલમાન ભાઈઓ તે ખાતર પોતાના પ્રાણ પાથરશે તેમજ હિંદુ ધર્મને પણ કોઈ નીંદી શકે નહિ અને જો નીંદા કરે તો હિંદુઓ તેને ખાતર મરી ફીટે ધર્મને ખાતર. મહાન વીરોએ કેટલાં દુઃખો સહન કરેલ છે તે આપણા ઈતિહાસો પણ રજુ કરી રહેલ છે! સત્યવાદી હરિશ્ચંદ્ર- ભક્ત પ્રહલાદ - રાણા પ્રતાપ- શીવાજી મહારાજ વગેરે નરવીરો ધર્મને ખાતર શું કરી ગયા છે તે આપણને ઈતિહાસો સુઝવે છે અમો એ તો આપીને જણાવીએ છીએ કે પીરાણા ધર્મ હિંદુ નથી. કચ્છમાં લગભગ ૯૦ ગામોમાં પીરાણા ધર્મ ચાલે છે છતાં પણ તે ધર્મનો બચાવ કરનાર એક પણ માણસ આજે શોધ્યો મળતો નથી. એ ધર્મને નામે લાખો રૂપીયા ખાઈ જનારા ધર્મગુરૂ સૈયદો અને કાકાઓ પણ આજે તેનો બચાવ કરવા માટે આવતા નથી ક્યાંથી આવે ખોટું હોય તેનો બચાવ કોણ કરે. સૈયદો પણ પોકારી પોકારીને કહે છે કે પીરાણા ધર્મ હિંદુઓનો નથી. છતાં પણ આપણે સમજતા નથી કેટલી અજ્ઞાનતા. હિંદુ દેવળો વિષે કેટલાક દાખલાઓ કહી બતાવેલ હતા. મનુષ્ય જીવનનું સાર્થક આપણને જરૂર સાધવું જોઈએ શ્રી. રામચંદ્રજી શ્રી કૃષ્ણ જેવા કે આપણે ભગવાન માનીએ છીએ તેઓએ પણ માતાને પેટ અવતાર લીધો હતો. આપણે તેઓનાં શરીરને નથી પુજતા પરંતુ કર્તવ્યને પુજીએ છીએ. આપણે શરૂઆતમાં ગુજરાતમાં રહેતા હતા અને પીરાણા પંથ સ્વીકાર્યો એટલે એવા રસાળ પ્રદેશનો પણ ત્યાગ કરવો પડ્યો. આપણા વડીલોએ કચ્છમાં આવી પ્રથમ [illegible]શ ગામ વસાવ્યું આપણે ૧૫૫૨ ની સાલમાં પીરાણા ધર્મ સ્વીકાર્યો ત્યારથી કરીને ૧૯૩૨-૩૩ સુધી એટલે લગભગ પોણા ચારસો વરસ પીરાણા ધર્મ પાળતા પરંતુ આ મરણો હિંદુઓમાં હતાં મરણ ને અગ્ની સંસ્કાર કરતા અને લગ્ન ચોરીથી કરતા પરં ત્યાર પછી સૈયદોએ આપણા વડીલોને ભારે જાહનતોથી રહિત કર્યા અને તેઓ

એટલે.. મૂર્તિને નહીં પણ ગુણોને પુંજીએ છીએ

realpatidar.com

KJ- BK-4-57

realpatidar.com

અને તેઓના શિષ્યોનો અજ્ઞાનને પોષ્યા. ઇમામશાહ પોતે પણ માનતા હતા
કે મેં શુદ્ધ સનાતની હિંદુઓને મારી જાળમાં ફસાવ્યા છે તે સાંગોપાંગ નામશે
નહિ અને ભવિષ્યમાં તેઓ જરૂર જાગ્રત થશે. એટલેજ પોતે સાચા કહેવડાવવા
ની ખાતર ભાંખી ગયા કે ધર્મમાં ધીંગાણાં થશે અને અઢી મુમન રહેશે. તો હવે
આપણે આપણું મુળ સ્વરૂપ ઓળખી ગયા છીએ અને પીરાણા પંથ હવે ટકીશ
કશે નહિ — સાંભળેલું ગ્રહણ કરવાથી શું ફાયદા થાય છે તે વિષે સુંદર દ્રષ્ટાંત આ
પેલ હતું. બ્રાહ્મણની ત્રણ શીખામણો ગ્રહણ કરવાથી. એક નારીનો નર્કમય સં
સાર સ્વર્ગમય બની ગયો અને પ્રભુનાં દર્શન કરી શકાયું તે વિષે.

દેખાદેખી થી પીરણા સતપંથ ચાલે છે.

આપણી જ્ઞાતિમાં પીરાણા પંથ દેખાદેખીથી ચાલતો હતો અને હજુ પણ કેટલાક
ભાઈઓ આપણાં ધર્માદા નાણાં હજારોની સંખ્યામાં કુરસ્તે જતાં રહેલ છે. તે પણ
અજ્ઞાનતાને લીધે દેખાદેખીથીજ. દેખાદેખી વિષે સુંદર દ્રષ્ટાંત મેઘરાજ કાબાજનું.
પીરાણા પંથી ભાઈઓ જે પાવળ પીએ છે તેમાં નાખવામાં આવતી નુરની ગોળી-
કદાપી પીતા નહિ એ ગોળી કઇ રીતે બને છે તેમ વર્ણવી બતાવું તો મુસલમાનોપ
ણ તમારો છાંટો લેશે નહિ એટલી. ખરાબ અને ભ્રષ્ટ છે તમો તે બાબતની ગોળી
ભાગે તો તે સહન કરી લેશે. પરંતુ આ ભ્રષ્ટ ગોળી મરતાં લગી પણ પીતા નહિ
જ્યાં સુધી આ ગોળીનું સેવન કરશો ત્યાં સુધી તમો સ્વજાતિ અને સ્વધર્મને
કદાપી ઓળખી શકશો નહિ કારણ કે એ વસ્તુ તમારા હૃદયમાં અજ્ઞાનતારૂપી
અંધારૂં કરી નિષ્ઠુર બનાવશે છે. માટે ગોળી તજો. કાકીઆયના મુખી વીરજી તથા
તેમના પુત્ર તરફથી. ખાનાંના મેડાની બારી માંથી. ભાષણો બંધ કરો એવો અવાજ આ
વેલ હતો. જેનો જવાબ. વક્તાઓ તરફથી. નકારમાં અપાયેલ હતો. અને જણાવવામાં
આવેલ હતું કે જો તમારો પંથ સાચો કહેવડાવવા માગતા હો તો અત્રે પધારી.
અમારી સાથે વાદવિવાદ કરો. જેનો જવાબ તેઓ તરફથી એમ મળેલ હતો કે
અમારો પંથ ખોટો છે છતાં પણ અમો માનશું અમો વાદવિવાદ કરવા માગતા
નથી પરંતુ અમારો પંથ ધોકો છે અને ધોકાના બચ્ચે મનાયશું. અભિમાન મારા
ધોકા સહન કરી લેશું પણ એવા નિષ્ઠુર પંથને કદાપી સ્વીકારશું નહિ એમ યુવકોના
કહેનો એ દ્રઢતાથી એકી અવાજે જવાબ આપેલ હતો. તાળીઓના ગડગડાટ સા
થે વક્તાએ ભાષણ શરૂ કર્યું સજ્જનો જે વ્યક્તિ અભિમાન કરે છે તેને પ્રભુના દરબારમાં
સ્થાન નથી. ગરૂડજીના અભિમાન વિષે... બાલ બહાર હોવાથી પ્રભુએ તેનો અસ્વીકાર
કરવા બાબત. સુંદર દ્રષ્ટાંત બંધુઓ આપણે ગંગા સ્વરૂપ જ્ઞાતિની સેવા સ્વીકારી છે તે
કદાપી છોડશું નહિ સત્ય વસ્તુ જણાવતાં જરા પણ અચકીશું નહિ સત્યને રસ્તે ચાલતાં
અને જ્ઞાતિ સેવામાં કદાચ આત્મ બલીદાન આપવાં પડશે તો તેમ કરવામાં અમ કોઈ જનેતા
નો કુંખને લજ્જવશું નહિ.... તાળીઓના ગડગડાટ—જય નાદ.

https://archive.org/details/bk1065/page/n5/mode/1up

KJ- BK- 4- 58

realpatidar.com

આપણી જ્ઞાતિ ધાર્મિક રિતરીવાજોમાં કેટલી પછાત છે તે સમજાવેલ હતું. પુનીનેશન આપવા બાબત. દેવીની ઉતપત બાબત. બ્રાહ્મણ કુટુંબનું દ્રષ્ટાંત આપેલ હતું.

આપણી જ્ઞાતિમાં ઘણા ખીસ્સાં ભરૂના લોભીઓની પુનીના પૈસા છે. પુનીના પૈસા વિષે. બ્રાહ્મણ અને ભૈરવ વિષે દ્રષ્ટાંત - વાંઝીયા મહેણું ટળવા બાબત સવાપાંચ શેર ગૌમાંસના કરાર બાબત. સુંદર દ્રષ્ટાંત આપી. પોતાનું સ્થાન લીધેલ હતું.

જેઠાભાઈ હરીભાઈ મેઘપરવાળા.

સનાતન ધર્મ ઝંડો અમર રહો. એવી શુભ લાગણી જાહેર કરી હતી. અને પીરાણા પંથી ભાઈઓ જે કહે છે કે ભાષણમાં અમારા પીરાણાનું નામ લેતા નહિ તેઓને હઠોણો જવાબ આપેલ હતો કે નામ લેયા વગર ખરાં ખોટાનું સ્પષ્ટીકરણ થઈ શકે નહિ અને જુદુ હરીતે જણાવવામાં અમો કદાપી અચકાશું નહિ આપણા વડિલોને સૈયદોએ એવી આશા કરેલ છે કે સત્સંગ સેવવો નહિ. તેનું કારણ કે આપણાને જ્ઞાન ઉત્પન ન થાય. સત્સંગ અને સંગઠન વિષે દ્રષ્ટાંત આપી બેસી ગયા હતા.

મુળજીભાઈ શીવજી ઝીંઝોડીવાળા.

આપણી જ્ઞાતિના સુધારક બંધુઓ આળીસ વરસથી. જ્ઞાતિ હિતના કાર્યમાં જહેમત ઉઠાવી રહેલ છે. જ્યારે હવે પરીણામ તદન નજીક દેખાય છે. સનાતન ઝંડાના રક્ષણાર્થે અમારા પ્રમુખ શ્રી રતનશીભાઈ તરફથી માથાં અર્પવાનું ફરમાન થશે તો તેમ કરવા અમો સનાતની યુવકો તૈયાર છીએ—તાળીઓ--

અમારા વડીલોને અમો વિનંતી કરીએ છીએ કે અમારા બોલવાથી જેમ આપની લાગણી દુભાય છે. તેમજ આપનો એ ધર્મ પાળવામાં અમારી પણ લાગણી દુભાય છે માટે અમો ધર્મ પાળવા સ્વછંદી. આપની પાસે આગ્રહીની નમ્ર માગણી કરીએ છીએ તો અત્યારે આ જાહેર સભામાં જવાબ આપવા કૃપા કરો.||જવાબ મળેલ નથી||

મારા યુવક બંધુઓ આપણી આજની સભા ઈતિહાસના પાને લખાવાની સનાતન ધર્મનો ઝુંડો વધાવાન બનાવી. ||ગુરુ ગોવિંદસિંહનાં બે બાળકો વિષે ઈતિહાસિક દાખલો|| ધર્મ નહિ છોડવા બાબત. તો મારા બીરાદરો આપણે ગમે તેટલાં સંકટ પડે તો પણ પાછી પાની કરશો નહિ- તાળીઓ- જયનાદ-

realpatidar.com

શીવગણભાઈ કાનજી રસલીઆવાળા.

મારા પીરાણા ધર્મ પ્રેમી વડીલોને વિનંતી કરૂં છું કે તમારા પરદેશ રહેતા બાળકોને પીરાણા ધર્મ પાળવા બદલ પગલે પગલે શરમાવું પડે છે અને પોતાની જાત છુપાવવી પડે છે માટે તેઓને ધર્મ પાળવા સંબંધમાં આગ્રહ આપો. અમો પીરાણા ધર્મમાં જેટલું પાખંડ હશે તે તો દરેક સ્થળે જણાવશું કારણ કે જણાવવા વગર ખરા ખોટાની ખબર નથી પડતી. કોઈ પણ હિંદુ ધર્મમાં એવો કાયદો નથી કે ધર્માદા રકમ

KJ- BK-4- 59

https://archive.org/details/bk1065/page/n6/mode/1up

realpatidar.com

કુરબાન આપવી પડે જ્યારે આ પાખંડી પંથમાં તો ઘરબાર બોલાઈ કરીને પણ દસોંદ વીસોંદ તો આપવી જ પડે. તો મારા વડીલોને વિનંતી કરૂં છું કે તમારો એ પણ કાંઈ પંથ ઘણા દહાડા ચાલ્યો. હવે ચાલશે નહિ માટે તમારૂં સ્વમાન તમારા હાથ માં રાખી અમોને આભારી આપો. આટલું બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

ખીમજી ભાઈ નાગજી મધલવાળા.

આપણે કુર્મ ઋષિના વંશજો છીએ એમ જણાવેલ હતું તથા ઇમામશાહ પોતાને ભગવાનનો દશમો અવતાર મનાવી ગયેલ છે તે તદન જુઠું છે કારણ કે આપણાં હિંદુ શાસ્ત્રો કહે છે કે ભગવાનનો દશમો અવતાર કળીયુગમાં થશે તો હજુ કળીયુગ ને વાર છે. માટે આપણે પાખંડી પંથ જરૂર છોડવો જોઈએ. અસ્તુ-

માવજી ભાઈ હીરજી વીરાણી વાળા

આપણે આપણા આચાર વિચાર સુધારવા ઉપર તાજેતરમાં આપણાં લગ્ન હતાં અને તે વખતે બે ઠેકાણે કન્યા ઓળખવી ન્યાતનો અનુભવ સિદ્ધ દાખલો અમોએ બતાવેલ હતો. મુખ ઓઘાને પરણાવનાર મુખીઓની અજ્ઞાનતાને લીધે કન્યા તથા વર બદલી જવાના દાખલાઓ ઘણે ઠેકાણે સાંભળવામાં આવે છે. અને તે અંધારૂં છેક લગ્ન થઈ જાય ત્યારે નામ આવે એટલે ખબર પડે છે. આવી રીતે જ્યાં લગ્નોપચાર હોય ત્યાં સંસાર નૌકા સુખરૂપ ક્યાંથી ચાલી શકે - યુવકો આપણા વડીલોની અજ્ઞાનતા દૂર કરવાના પ્રયાસો આપણને કરવા અને તેઓ ને સમજાવવા છતાં પણ જો ન સમજે અને આપણા સનાતન ધર્મને આંચ આવતી હોય તો તેવા વડીલો નો ત્યાગ કરવામાં પણ આપણને બીલકુલ ડર કરતા નથી. વહાલી વસ્તુ છોડીએ પણ ધર્મ છોડતા નહિ. અસ્તુ- હવે હું બેસી જવાની રજા માગું છું-

પ્રેમજી ભાઈ ખીમજી વીરાણી. વાળા.

સુધારક ભાઈઓએ આટલી અગાઉ જે મહેનત કરી છે તે હમણાં ગણવાર તેથી પૂર્ણ પણે સફળ થઈ છે. અને હવે તો શુભ પરીણામ તદન નજીક હોવાનું છે એમ આપણા માં આવેલ જાગૃતી આપણને સુચવી રહેલ છે. આજે કચ્છ માં ઘણાંક ગામો માં સનાતન ધર્મનાં શ્રી. લક્ષ્મી નારાયણનાં મંદિરો બંધામાં આવે છે તે સુધારક ભાઈઓ ને જ આભારી છે. મારા યુવાન બંધુઓને વિનંતી કરૂં છું કે આપણે આપણા ધર્મ કોઈને કુરબાન પળાવવો નહિ. અને આપણને પણ કોઈ ધર્મ પળાવશે નહિ બલ્કે ધર્મ બાબત આગ્રહ રહેશું આપણા અજ્ઞાન વડીલો કહે છે કે અમારી જ્ઞાતિ માં ધર્મ બાબત કજીઆ ચાલે છે ને ધર્મ બાબત નથી પરંતુ આચરણ બાબત છે. ધર્મનો બીજ કેટલાક હિંદુ ભાઈઓ જુદા જુદા પાળે છે. પરંતુ આ મરણ ગોળીયાનાં એકેજ હોય છે.

https://archive.org/details/bk1065/page/n7/mode/1up
-Kadiya Athamana Laxminarayan Inauguration (1065)

KJ- BK- 4-60

realpatidar.com

ત્યાર બાદ કેળવણી તથા આપણી ધર્માદા જુદી શુભ કાર્યોમાં ખર્ચ વિ. બાબત કેટલીક વ્યાખ્યા કરી પોતાને સ્થાને બેસી ગયા હતા.

પ્રમુખ ભાઈ શીવજી વીરાણી.

અમો જ્યારે ખોંભડી જતા હતા. ત્યારે અહીંના યુવક બંધુઓની ભાવના જોઈ ત્યારથી અમોને મનમાં કલ્પના થતી હતી કે આ ગામમાં સભા ક્યારે થાય અને અમો લાભ લઈએ. જે શુભ દિવસ આજે પ્રાપ્ત થયો. તે બાબત પ્રભુનો આભાર માનું છું આપણા ને જે ચીજ વહાલી હોય તે આપણે વહેવારમાં જુદી જોઈએ છીએ જેમકે શ્રીરામ-કૃષ્ણ શીવાજી-અર્જુન. વગેરે હિંદુ મહાન વીરોનાં નામો આપણે હિંદુઓ આપણા. બાળકોને આપીએ છીએ જેવાં કે રામજી કરશન શીવજી અરજણ- તેવીજ રીતે જેને પીરાણાપંથ વહાલો હોય તે લોકો એ પંથના ધર્મગુરૂઓનાં નામ. પોતાના બાળકોને શામાટે આપતા નથી તેમ કરતાં શરમ શામાટે આવેછે અને જો શરમ આવે તો. એ ધર્મ સાચો છે એમ મનાયી જ કેમ શકાય. અસ્તુ હવે હું બેસી જવાની રજા લઉં છું.

શ્રી. રતનશી ભાઈ ભીમજી વીરાણી બાબા.

બંધુઓ આપણે એક છીએ અને એક રહેવાના છીએ. અત્રે બોલનાર વિદ્વા વક્તાઓ આભાર છે અને સત્ય અસત્ય જણાવવામાં કોઈના દિલ દુખ્યા હોય તેમ નથી અમો અમારા વિચારો જણાવવામાં કદાપી અચકાશું નહિ યુવકો આપણને કયો ધર્મ પાળવો તે આપણી મનખુશી પર આધાર છે. તેમાં આપણને કોઈ પણ અટકાવી શકનાર નથી. અને આ કાર્ય આપના મુખી તરફથી. અત્યારે થોડા વખત પહેલાં જણાવવામાં આવેલ છે કે અમોએ અમારા ગામના યુવાનોને મારા તરફથી ધર્મ પાળવા સબંધમાં છૂટ આપી દીધેલ છે અને કોઈ વાતે અટકાવતા નથી. મેં મારી જીંદગી જ્ઞાતિ સેવામાં અર્પણ કરીછે જો મારી સેવા સત્ય હશે તો વડીલોનાં હૃદય આજ નહિ તો થોડા સમય બાદ પણ જરૂર પીગળશે. અને અમારૂં બોલેલું સત્ય લાગશે આપણે એ મનુષ્ય અવતારમાં કંઈ પણ કર્તવ્ય ન કરી જઈએ. તો આપણે નર્કના અધિકારી બનીએ છીએ. એક ઢોર આપણી. જીંદગી ભર સેવા કરી અને મરે છે. ત્યારે પણ. પોતાનું ચામડું આપણને આપતો મરે છે અને કહે છે કે મારાં ચામડાં માંથી. જોડા કરાવી પહેરજો એટલે તમો સુખી થશો. ત્યારે એક ઢોર પણ આટલી સેવા કરે છે અને આપણે કંઈ ન કરી શકીએ તો ધિક્કાર છે આપણી જીંદગીને. આપણી વીરાનનાં નાણાં હરામનાં નથી. પરસેવાના ટીપે ટીપે પૈસો પેદા થાય છે. તો એ ધર્માદા પૈસાનો ખોટી રીતે ગેર ઉપયોગ ન કરવાની. હું મારા વડીલોને વિનંતી કરૂં છું સંપ ત્યાંજ ધર્મ. જો આપણામાં સંપ હોય તો એવો કોઈ ધર્મ નથી. જ્યારે આપણે આજે. ધર્મને નામે ખોટી ભડાભડ કરી રહેલ છીએ. કેટલી બધી અજ્ઞાનતા.

ભક્ત તુલસીદાસનું દૃષ્ટાંત- રામ ભક્ત હોવા બાબત-

realpatidar.com

https://archive.org/details/bk1065/page/n8/mode/1up
-Kadiya Athamana Laxminarayan Inauguration (1065)

KJ- BK - 4 - 61 (END)

realpatidar.com

તેવીજ રીતે ધર્મ પાળવા સબંધમાં આપણા પર કોઈ ફરજ પાડી શકતો નથી અને શકશે પણ નહિ. હવે સભા સમાપ્ત કરવામાં આવે છે.

સભામાં સંખ્યા આશરે ૧૫૦૦ માણસોની હતી.

સમાપ્ત

સમય-૧૧ા રાત્રી.

પ્રમુખની સહી – પા. હંસરાજ માના ની સહી.

દા: વિશનજી વીરજી ના.

કાદીઆય આથમણી તા. ૨૮/૫/૫૬

આજે સવારમાં અમો સનાતની ભાઈઓ માટે સંગઠન પ્રચાર નો કેસર જ જવા માટે સમાજના પ્રમુખ શ્રી રતનશીભાઈ વગેરે ભાઈઓને રોકવામાં આવેલ હતા. લગભગ ૯ વાગે અહીંના મુખી વીરજી તથા બીજા કેટલાક આગેવાનો પ્રમુખશ્રીને ઉતારે આવેલા હતા. જ્યાં પીરાણા પંથ વિષે વાદવિવાદ ચલાવવામાં આવેલ હતો. અને સમાજના પ્રમુખશ્રીએ સિદ્ધાંતો સહિત પુરવાર કરી આપેલ હતું કે પીરાણા પંથ હિંદુઓને માટે તદન અણછાજતો છે. અને તેઓએ તે કબુલ પણ કરેલ હતું અને જણાવ્યું હતું કે અમો પણ સમજી ગયા છીએ કે આ પંથ ખોટો છે. અને આજ નહિ તો બાર માસ આગળ પાછળ પણ આપણને એકે પંથ જવા વગર છુટકો નથી. પણ અમારામાં ઘણા લાંબા વખતથી સંસ્કારો પડી ગયા છે તે જલ્દી દૂર થશે નહિ એમ જણાવેલ હતું અને વીરજી મુખીએ અહીંના યુવકોને જણાવેલ હતું કે તમો આપણામાં વધારે વિખવાદ કરશો નહિ જેના જવાબમાં યુવકો એ જણાવેલ છે કે અમારો વીખવાદ કરવાનો સિદ્ધાંતજ નથી. કર્યો નથી. અને કરશું પણ નહિ પરંતુ તમો જે પીરપંથનાં બીજ રોપો છો તે અટકાવશો એવી વિનંતી કરીએ છીએ. આવી રીતે ખૂબ ચર્ચા ચલાવી. બપોરના બાર વાગે તેઓ પોતપોતાને ઘેર ગયા હતા અને ભોજન કાર્ય પતાવી. ૩ વાગે પ્રમુખશ્રી તથા મારાજ દયાળદાસજી વગેરે પોતાને સ્થાને જવા રવાના થયા હતા. ગામના તમામ સનાતની બંધુઓ ગામ સુધી મોકલાવવા આવેલ હતા. અને ગામ તરફથી એક ગાડું મારાજ દયાળદાસજી વગેરેને કોઈટડા સુધી મુકવા આવેલ હતું અને બીજું નખત્રાણા સુધી આવેલ હતું. અસ્તુ

realpatidar.com